

અરબી-ગુજરાતી

કુરઆને મજીદ

પારા-૩

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાચોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● **LIKE US ON FACEBOOK** ●

HOME | કુરઆને મજીદ (પારા-૩) -1 | **VISIT US**

નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે www.hajinaji.com પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જાણ કરવા વિનંતી.

hajinajitrust@gmail.com

અનુક્રમણિકા

નં.	સૂરાનું નામ	પેજ
૨	સૂર-એ-બકરહ (આયત ૨૫૩ થી ૨૮૬)	૪
૩	સૂર-એ-આલે ઈમરાન (આયત ૧ થી ૯૧)	૪૬

سورة البقرة / સુરચે બકરહ

تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَى بَعْضٍ مِّنْهُمْ مَّنْ كَلَّمَ
اللَّهُ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۗ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ
الْبَيِّنَاتِ وَإِيَّانَهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلَ
الَّذِينَ مِن بَعْدِهِمْ مِّنْ بَعْدِ مَا جَاءَتْهُمْ الْبَيِّنَاتُ وَلَكِن
اِخْتَلَفُوا فَمِنْهُمْ مَّنْ آمَنَ وَمِنْهُمْ مَّنْ كَفَرَ ۗ وَلَوْ شَاءَ اللَّهُ مَا
اقْتَتَلُوا أَنفُسَهُمْ وَاللَّهُ يُفَعِّلُ مَا يُرِيدُ ۗ

(૨૫૩) આ રસૂલોમાંથી અમોચે કેટલાકોને
કેટલાકો ઉપર શ્રેષ્ઠતા આપી છે; તેઓમાંથી એવા
પણ છે જેમની સાથે અલ્લાહે વાતચીત કરી છે

તથા તેઓ માંહેના કેટલાકોના દરજ્જા વધાર્યા છે; અને મરિયમના પુત્ર ઈસાને અમોએ ખુલ્લા મોઅજિઝા આપ્યા તથા રૂહુલકુદ્દસ (જબ્રીલ) દ્વારા તેને સબળ બનાવ્યો; અને જો અલ્લાહને મંજુર હતે તો તે (પયગમ્બરો)ના પછીના લોકો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ આવી ચૂકયા બાદ માંહોમાંહે લડી મરતે નહિ, પરંતુ તેમણે મતભેદ કર્યો, પછી તેઓમાંથી કોઈ ઈમાન લાવ્યો અને તેઓમાંથી કોઈએ ઈન્કાર કર્યો; અને જો અલ્લાહ યાહતે તો તેઓ માંહોમાંહે લડતે નહિ; પરંતુ અલ્લાહ જે ધારે છે તે કરે છે.

يَأْتِيهَا الَّذِينَ آمَنُوا أَنْفِقُوا مِمَّا رَزَقْنَاكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَكُمْ
 لَا بَيْعَ فِيهِ وَلَا خُلَّةً وَلَا شَفَاعَةً ۗ وَالْكَافِرُونَ هُمُ
 الظُّلُمُونَ ﴿١٥٣﴾

(૨૫૪) અથ ઈમાન લાવનારાઓ ! અમોએ તમને
 જે કાંઈ આપ્યું છે તેમાંથી તે દિવસ આવી પહોંચે
 તે પહેલાં (અમારી રાહમાં કાંઈક) ખરચ કરો કે જે
 (દિવસ)માં ન તો લેવડ દેવડ હશે ન મિત્રાચારી
 અને ન ભલામણ; અને ઈન્કાર કરનારાઓ પોતે જ
 ઝુલમગાર છે.

اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ ۗ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَّةٌ وَلَا نَوْمٌ ۗ
 لَهُ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ

إِلَّا بِإِذْنِهِ ۖ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۗ وَلَا
 يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۗ وَسِعَ كُرْسِيُّهُ
 السَّمَاوَاتِ وَالْأَرْضَ ۗ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۗ وَهُوَ الْعَلِيُّ
 الْعَظِيمُ ﴿٧٥﴾

(૨૫૫) અલ્લાહ તે છે કે જેના સિવાય અન્ય કોઈ
 પૂજ્ય નથી, તે હંમેશ જીવંત (અને) સ્વબળથી
 કાયમ રહેલો છે, ન તેને ઝાંકુ આવે છે અને ન
 ઊંઘ; જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ જમીનમાં
 છે તે (સઘળું) તેનું જ છે; કોણ એવો છે જે તેની
 આજ્ઞા વિના તેની હજૂરમાં (કોઈના માટે) ભલામણ
 કરી શકે; તે તે (લોકો)ના ભવિષ્ય તથા ભૂતકાળની

હકીકત જાણે છે, અને તેઓ તેના જ્ઞાનમાંના રજકણ બરાબર (જ્ઞાન)ની પણ હદ બાંધી શકતા નથી, સિવાય તેના કે જેટલું તે યાહે, તેનું રાજ્યાસન આકાશો અને જમીનમાં ફેલાયેલું છે, અને એ બંનેનું રક્ષણ તેને (જરાય) બોજારૂપ લાગતું નથી, અને તે ઉચ્ચ મોભા (અને) બુઝુર્ગીવાળો છે.

لَا إِكْرَاهَ فِي الدِّينِ ۚ قَدْ تَبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَنْ يَكْفُرْ
 بِالطَّاغُوتِ وَيُؤْمِنُ بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ
 لَا انْفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴿١٥٦﴾

(૨૫૬) ધર્મમાં કોઈ જાતની જબરદસ્તી નથી, ખરેજ હિદાયત (સન્માર્ગ) ગુમરાહી (કુમાર્ગ)થી જુદી (જાહેર) થઈ ચૂકી છે, પછી જે કોઈ જુઠા ખુદાઓ (બુતો)નો ઈન્કાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે તો ખચીતજ તેણે અલ્લાહની મજબૂત રસીને પકડી લીધી, કે જે કદી તૂટનાર નથી; અને અલ્લાહ સંપૂર્ણ સાંભળનાર (તથા) જાણનાર છે.

اللَّهُ وَالَّذِينَ آمَنُوا لَا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۗ
 وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَهُمُ الطَّاغُوتُ ۗ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ
 إِلَى الظُّلُمَاتِ ۗ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۗ هُمْ فِيهَا خَالِدُونَ ﴿٢٥٦﴾

(૨૫૭) જે લોકો ઈમાન લાવ્યા અલ્લાહ તેમનો હિમાયતી છે, તે તેમને (ગુમરાહીના) અંધકારમાંથી કાઢી (હિદાયતના) પ્રકાશમાં લઈ આવે છે; અને જેઓએ (સત્ય ધર્મનો) ઈન્કાર કર્યો તેમના હિમાયતી શેતાનો છે જે તેમને (ઈમાનના) પ્રકાશમાંથી કાઢી (અધર્મનો) અંધકારમાં લઈ જાય છે; આ (લોકો) જ આગના રહેવાસી છે, જેમાં તેઓ હંમેશને માટે રહેનાર છે.

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ حَاجَّوْا بَرَّهُمْ فِي رَبِّهِ أَنْ أْتَهُ اللَّهُ الْمَلِكُ مَرَدُّ
 قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ ۗ قَالَ أَنَا أُحْيِي وَأُمِيتُ ۗ
 قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا

مِنَ الْمَغْرِبِ فَجَبَّتْ الَّذِي كَفَرَتْ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ
الظَّالِمِينَ ﴿١٥٨﴾

(૨૫૮) (અચ રસૂલ !) શું તે (નમરૂદ)ની સ્થિતિ પર નજર નથી નાખી જેણે ઈબ્રાહીમ સાથે તેના પરવરદિગાર સબંધી દુરાગ્રહ કર્યો એટલા માટે કે તે (નમરૂદને) અલ્લાહે સલ્તનત આપી હતી. જ્યારે ઈબ્રાહીમે કહ્યું કે મારો પરવરદિગાર તે છે જે જીવાડે છે અને મારે (પણ) છે (ત્યારે) તેણે કહ્યું કે હું પણ જીવાડુ છું અને મારું છું; (પછી) ઈબ્રાહીમે કહ્યું કે નિસંશય અલ્લાહ સૂચને પૂર્વ બાજુએથી ઉગાડે છે (તો) તું તેને પશ્ચિમ બાજુએથી ઉગાડ,

આથી તે નાસ્તિક ગૂંચવાડામાં પડ્યો; અને
અલ્લાહ ઝુલમગાર લોકોને માર્ગ દેખાડતો નથી.

أَوْ كَالَّذِي مَرَّ عَلَى قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَى عُرُوشِهَا ۚ قَالَ أَنَّى
يُحْيِي هَذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۚ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ
قَالَ كَمْ لَبِثْتُ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَلْ
لَبِثْتُ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَى طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۗ
وَانظُرْ إِلَى حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِلنَّاسِ وَانظُرْ إِلَى الْعِظَامِ
كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۖ فَلَمَّا تَبَيَّنَ لَهُ ۗ قَالَ
أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿٣٥﴾

(૨૫૯) અથવા (અથ રસૂલ!) તે (ઓઝૈર નબીના જેવા શખ્સની સ્થિતિ) પર (નજર નાખી નથી) જે એક વસ્તી પાસેથી પસાર થયો જે પોતાના છાપરાંઓ પર ઊંધી વળી ગઈ હતી, (તે જોઈને) તે કહેવા લાગ્યો કે અલ્લાહ આ વસ્તીના નાશ (પામ્યા) પછી તેને પાછી કેવી રીતે સજીવન કરશે ? આથી અલ્લાહે તેને સો વર્ષ માટે મૃત્યુ આપ્યું પછી તેને સજીવન કર્યો; (પછી) પૂછ્યું કે તું (આ સ્થિતિમાં) કેટલી મુદત રહ્યો? જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી (પણ) ઓછું રહ્યો; (અલ્લાહે) ફરમાવ્યું (નહિ), બલકે તું સો વર્ષ સુધી રહ્યો હવે તારા ખોરાક તથા પાણી તરફ

નજર કર, વર્ષો વીત્યાં છતાં તેમની સ્થિતી બદલાઈ નથી; અને તારા ગઘેડા તરફ (પણ) જો; અને (અમે ઈચ્છીએ છીએ કે) તને લોકો માટે એક નિશાની બનાવીએ, અને તે (ગઘેડા)ના હાડકાં તરફ જો કે અમે તેમને કેવી રીતે (પાછા) જોડી દઈએ છીએ, પછી (કેવી રીતે) તેના ઉપર માંસ ચઢાવીએ છીએ; સારાંશ કે જ્યારે તેની સામે આ વાત સ્પષ્ટ થઈ ગઈ, ત્યારે તે કહેવા લાગ્યો કે હું જાણું છું કે ખરે જ અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવનાર છે.

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَىٰ ۗ قَالَ أُولَٰئِكَ
 تُؤْمِنُونَ ۗ قَالَ بَلَىٰ وَلَٰكِن لِّيَطْمَئِنَّ قُلُوبِي ۗ قَالَ فَنُحِذُّ أَرْبَعَةً مِّنَ

الطَّيْرِ فَضَرُهِنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَىٰ كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا
ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا ۗ وَاعْلَمْ أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ ﴿٣٦﴾

(૨૬૦) અને (અય રસૂલ! તે સમયને યાદ કર) જ્યારે ઈબ્રાહીમે અરજ કરી કે અય મારા પરવરદિગાર ! તું મરેલાઓને કેવી રીતે સજીવન કરે છે તે મને દેખાડ; ફરમાવ્યું શું તને વિશ્વાસ નથી? અરજ કરી, હા (મને વિશ્વાસ છે) પણ એટલા માટે (દેખાડી દે) કે મારા મનનું સમાધાન થઈ જાય; ફરમાવ્યું ત્યારે પક્ષીઓમાંથી ચાર (પક્ષીઓ) લે, પછી તેમને તારા ઉપર હેવાયલા કરી લે (પછી તેમના કટકે કટકા કરી) જુદા જુદા પહાડ ઉપર તેમનામાંથી એકેક કટકો મૂક પછી તેમને બોલાવ

તેઓ તરત જ તારી પાસે દોડતા આવશે; અને આ સમજી લે કે ખરે જ અલ્લાહ સમર્થ (અને) હિકમતવાળો છે.

مَثَلُ الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ
أَنْبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِائَةٌ حَبَّةٌ ۗ وَاللَّهُ
يُضْعِفُ لِمَنْ يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ ﴿٣١﴾

(૨૬૧) તે (લોકો)નો દાખલો કે જેઓ પોતાનો માલ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરે છે એક દાણાના દાખલા જેવો છે કે જેમાંથી સાત ડુંડા નિકળે છે કે (જેના) ડુંડા (કણસલાં)માં સો દાણા હોય છે; અને

અલ્લાહ જેના માટે ચાહે છે બમણા યોગણા કરી દે છે; અને અલ્લાહ સર્વવ્યાપી (અને) સર્વજ્ઞ છે.

الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ ثُمَّ لَا يُتَّبِعُونَ مَأْ
انْفِقُوا مِمَّا وَلَا أَدَىٰ لَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۖ وَلَا خَوْفٌ
عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿٣٣﴾

(૨૬૨) જે લોકો પોતાનો માલ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરે છે પછી જે ખરચ્યું છે તેનો ઉપકાર ચઢાવતા નથી તેમ (દાન સ્વીકારનારને) કાંઈ ઈજા (પણ) પહોંચાડતા નથી, તેમના માટે તેમના પરવરદિગાર પાસે (સુંદર) બદલો છે, અને તેમને ન તો કોઈ ભય રહેશે અને ન તો ઉદાસ થશે.

قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّنْ صَدَقَةٍ يَتَّبِعَهَا أَذَى ۗ وَاللَّهُ

غَنِيٌّ حَلِيمٌ ﴿٣٣﴾

(૨૬૩) માયાળુ શબ્દો અને ક્ષમાવૃત્તિ એવા એક દાન કરતાં બહેતર છે કે જે (દાન)ની પાછળ ઈજા હોય; અને અલ્લાહ બેપરવાહ (અને) સહનશીલ છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَبْطُلُوا صَدَقَتِكُمْ بِالْمَنِّ وَالْأَذَى ۗ
كَالَّذِي يُنْفِقُ مِمَّا لَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ
الْآخِرِ ۗ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ
فَتَرَكَهُ صَلْدًا ۗ لَا يَقْدِرُونَ عَلَى شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّهُ لَا
يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ﴿٣٣﴾

(૨૬૪) અથ ઈમાન લાવનારાઓ! તમે તમારા
સદકા (દાન-ધર્મ) ને ઉપકાર ચઢાવીને કે
(લેનારને) ઈજા (માનહાની) પહોંચાડીને વ્યર્થ કરો
નહિ, તેની જેમ કે જે પોતાની દોલત લોકોને
દેખાડવા કાજે (દાનમાં) ખર્યે છે અને અલ્લાહ
તથા કયામત પર ઈમાન રાખતો નથી; જેથી તેનો
દાખલો એક લીસા પત્થરની શીલા જેવો છે કે
જેના ઉપર માટી (ચઢી ગઈ) હોય, પછી તેના
ઉપર ધોધમાર વર્ષા થાય અને તેને સફાયટ
(કરી) છોડી જાય; એવી રીતે તેઓએ જે કાંઈ
કમાવ્યું છે તેના કોઈ પણ ભાગ ઉપર (તેઓ) સત્તા

ધરાવતા નથી; અને અલ્લાહ નાસ્તિકોનાં ટોળાને
(કદીપણ) સન્માર્ગ દેખાડતો નથી.

وَمَثَلُ الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ
وَتَشْبِيهًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ
فَاتَتْ أَكْطَافَهَا ضِعْفَيْنِ ۗ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطُلُّ ۗ وَاللَّهُ
بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ﴿٣٦﴾

(૨૬૫) અને તે લોકોનો દાખલો કે જેઓ પોતાનો
માલ (કેવળ) અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે
અને પોતાના દિલોને મજબૂત બનાવવા માટે ખર્ચ
કરે છે. એક (એવા હર્યા ભર્યા) બગીચાના જેવો છે.
કે જે ઊંચાણમાં હોય અને તેના પર ધોધમાર

વરસાદ વરસે પછી તે બમણાં ફળ આપે. પછી જો તેના પર જોરથી વૃષ્ટિ ન થાય તો ઝરમર વર્ષા પુરતી છે; અને જે તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.

أَيُّدٌ أَحَدُكُمْ أَنْ تَكُونَ لَهُ جَنَّةٌ مِّنْ نَّخِيلٍ وَأَعْنَابٍ تَجْرِي
 مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ لَهُ فِيهَا مِنْ كُلِّ الثَّمَرَاتِ ۖ وَأَصَابَهُ الْكِبَرُ
 وَلَهُ ذُرِّيَّةٌ ضَعَفَاءُ ۗ فَأَصَابَهَا إِعْصَارٌ فِيهِ نَارٌ فَاحْتَرَقَتْ ۗ
 كَذَلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ ﴿٣٦﴾

(૨૬૬) શું તમારાંથી કોઈપણ આ પસંદ કરશે કે તેના (માટે) ખજૂર તથા દ્રાક્ષનો અકેકો (એક-એક) બગીચો હોય (કે) જેની હેઠળ નદીઓ વહેતી હોય,

જેમાં તેના માટે દરેક પ્રકારના ફળ (ફળાદિ) હોય, અને તેને ઘડપણ આવી ગયું હોય અને તેની સંતતિ કમજોર હોય, પછી એકાએક તે (બગીચા)માં એક વાવાઝોડું આવી પડે જેમાં આગ (પણ) હોય કે જેનાથી તે (બગીચો) બળી (ભસ્મ) થઈ જાય; આવી રીતે અલ્લાહ (પોતાની) આયતો તમારા (લાભ) માટે સ્પષ્ટ કરીને વર્ણવે છે કે જેથી તમે મનન કરો.

يَأَيُّهَا الَّذِينَ آمَنُوا أَنْفِقُوا مِنْ طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَحَمَىٰ
 أَخْرَجْنَا لَكُمْ مِنَ الْأَرْضِ ۖ وَلَا تَيَسَّبُوا الْحَبِيثَ مِنْهُ

تَنْفِقُونَ وَلَسْتُمْ بِأَخِيذِيهِ إِلَّا أَنْ تُغْبِضُوا فِيهِ ط وَعَلِمُوا أَنَّ

اللَّهُ غَنِيُّ حَمِيدٌ ﴿٣٦﴾

(૨૬૭) અય ઈમાન લાવનારાઓ ! તમોએ જે કાંઈ નેક કમાણી કરી છે તથા અમોએ તમારા માટે જમીનમાં (જે) કાંઈ ઉત્પન્ન કર્યું છે તેમાંથી અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો, અને તેમાંથી એવી ખરાબ વસ્તુ કે જે (તમારા ઉપયોગમાં) આંખ મીંચામણાં કર્યા વગર તમે પોતે લ્યો નહિ તેવી વસ્તુ દાનમાં આપવાનો વિચાર (સરખોય) કરશો નહિ; અને આ સમજી લો કે ખરેજ અલ્લાહ બેપરવાહ (અને) વખાણને પાત્ર છે.

الشَّيْطَانُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَأْمُرُكُمْ بِالْفَحْشَاءِ ۗ وَاللَّهُ يَعِدُكُمْ
مَغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ ﴿٣٧﴾

(૨૬૮) શેતાન તમને (દાન આપવાથી) ગરીબ થઈ જશો એમ (કહીને) બીવરાવે છે. અને નિર્લજ્જપણે (એટલે કંજૂસાઈથી) વર્તવાની આજ્ઞા કરે છે, અને અલ્લાહ પોતાના તરફથી ક્ષમા અને ભરપુર રોજીનો વાચદો કરે છે; અને અલ્લાહ સર્વવ્યાપી (અને) સર્વજ્ઞ છે.

يُؤْتِي الْحِكْمَةَ مَنْ يَشَاءُ ۗ وَمَنْ يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْرًا
كَثِيرًا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ ﴿٣٩﴾

(૨૬૯) તે જેને યાહે છે હિકમત (સદબુદ્ધિ) આપે છે, અને જેને (અલ્લાહના તરફથી) હિકમત આપવામાં આવી તો ખરેજ તેને ખૂબીઓની મહાન દોલત આપવામાં આવી; અને બુદ્ધિશાળીઓ સિવાય અન્ય કોઈ બોધ ગ્રહણ કરતું નથી.

وَمَا أَنْفَقْتُمْ مِنْ نَفَقَةٍ أَوْ نَذَرْتُمْ مِنْ نَذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهَا ط
وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ ﴿٤٠﴾

(૨૭૦) અને તમોએ (અલ્લાહના માર્ગમાં) જે દાન આપ્યું અથવા જે કાંઈ (પણ) માનતા તમોએ માની તો બેશક અલ્લાહ તે જાણે છે; અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી.

إِنْ تَبَدُّوا الصَّدَقَاتِ فَبِعَبَا هِيَ ۚ وَإِنْ تُخْفُوهَا وَتُوتُّوهَا
 الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَكُمْ ۖ وَيُكَفِّرُ عَنْكُمْ مِّنْ سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ
 بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ﴿٢٤١﴾

(૨૭૧) જો તમે (તમારા) સદકા ખુલ્લી રીતે આપો
 તો તે સારું છે, અને જો તમે છુપું રાખીને
 મોહતાજોને આપો તો તે તમારા હકમાં બેહતર છે;
 અને તે (છુપી રીતે આપવું) તમારા કેટલાક
 ગુનાહોનું નિવારણ કરી દેશે; અને તમે જે કાંઈ કરો
 છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.

لَيْسَ عَلَيْكَ هُدَاهُمْ وَلَكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۗ وَمَا
 تُنْفِقُوا مِنْ خَيْرٍ فَلَا نُفْسِكُمْ ۗ وَمَا تُنْفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ

اللَّهُ ط وَمَا تَنْفِقُوا مِنْ خَيْرٍ يُؤْفَ إِلَيْكُمْ وَأَنْتُمْ لَا
تُظَلِّمُونَ ﴿٧٤٢﴾

(૨૭૨) (અથ રસૂલ) તેમને સન્માર્ગે ચઢાવવું તારા માથે નથી પણ અલ્લાહ જેને યાહે છે તેને સન્માર્ગે પહોંચાડી દે છે; અને તમે જે કાંઈ દાનમાં વાપરો તે તમારા પોતાનાજ (લાભ) માટે છે; અને તે (દાન કેવળ) અલ્લાહની ખુશી સંપાદન કરવા સિવાય બીજા કોઈ હેતુસર કરો નહિ; અને તમારા માલમાંથી જે કાંઈ પણ તમે દાનમાં વાપરશો તેનો પૂરેપૂરો બદલો તમને આપવામાં આવશે અને તમને જરાપણ અન્યાય કરવામાં આવશે નહિ.

لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا
 فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ ۖ
 تَعْرِفُهُمْ بِسِيئِهِمْ ۖ لَا يَسْأَلُونَ النَّاسَ إِحْفَاطًا وَمَا تُنْفِقُوا
 مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ ﴿٤٦﴾

(૨૭૩) આ ખયરાત એવા મોહતાજોનો હક છે કે જેઓ અલ્લાહના માર્ગમાં ઘેરાઈ ગયા હોય અને કોઈપણ રીતે પૃથ્વી પર (રોજી મેળવવાને) જઈ શકતા ન હોય; અજ્ઞાની માણસો તેમને તેમના સ્વમાનના કારણે (સવાલ ન કરતા હોવાથી) શ્રીમંત ધારે છે, (પણ) તું તેમની મુખમુદ્રા પરથી તેમને ઓળખી કાઢશે (કે ખરેખર તેઓ મોહતાજ

છે), તેઓ લોકો પાસે કરગરીને સવાલ કરતા નથી; અને તમારા માલમાંથી જે કાંઈ ખર્ચ કરશો તે બેશક અલ્લાહ તેનાથી વાકેફ છે.

الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً
فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۖ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ
يَحْزَنُونَ ﴿٣٤﴾

(૨૭૪) જે લોકો રાત દિવસ પોતાનો માલ છૂપી રીતે અને ખુલ્લી રીતે (અલ્લાહના માર્ગમાં) વાપર્યા કરે છે, તેનો બદલો તેમના પરવરદિગાર પાસે તેમને (પ્રાપ્ત) થશે અને તેમને (કયામતમાં)

ન તો કાંઈ ભય રહેશે અને ન તો તેઓ ઉદાસ થશે.

الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي
يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَيْسِ ط ذَلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ
مِثْلُ الرِّبَا وَأَحَلَّ اللَّهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ط فَمَنْ جَاءَهُ
مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانْتَهَى فَلَهُ مَا سَلَفَ ط وَأَمْرُهُ إِلَى اللَّهِ ط
وَمَنْ عَادَ فَأُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ ﴿٣٤﴾

(૨૭૫) જે લોકો રિબાઅ (વ્યાજ) ખાય છે તેઓ (કબરમાંથી નીકળી) ઉભા થશે નહિ પણ તેની જેમ કે જેને શેતાને અડકીને પાગલ કરી નાખ્યો હોય; આ (શિક્ષા) એ માટે કે તેઓ કહેતા હતા કે વેપારના મામલા પણ રિબાઅના જેવાજ છે; જોકે

ખરી રીતે તો અલ્લાહે વેપારને હલાલ કર્યો છે અને રિબાઅને હરામ ઠરાવ્યો છે; માટે જે શખ્સ પાસે તેના પરવરદિગાર તરફથી નસીહત આવી અને તે (રિબાઅ ખાતાં) અટકી ગયો તો જે કાંઈ (આ) પહેલાં થઈ ગયું છે તે માટે દરગુજર કરવામાં આવશે; અને તેનો મામલો અલ્લાહને હસ્તક છે; અને જેણે ફરીથી એવું જ કર્યું (તો) તેઓજ આગના રહેવાસીઓ છે, જેમાં તેઓ હંમેશ રહેનાર છે.

يَمْحَقُ اللَّهُ الرِّبَا وَيَزِيذُ الصَّدَقَاتِ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ

أَثِيمٍ ﴿١٦١﴾

(૨૭૬) અલ્લાહ રિબાઅને નાબૂદ કરી દે છે અને ખેરાતને વધારી દે છે; અને અલ્લાહ કોઈપણ અનુપકારી ગુનેહગારને દોસ્ત રાખતો નથી.

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا
الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۖ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ
يَحْزَنُونَ ﴿٣٤﴾

(૨૭૭) બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા સત્કાર્યો કર્યા તથા નમાઝ પઢી અને ઝકાત આપી તેમના માટે તેનો બદલો તેમના પરવરદિગાર પાસે હશે, અને તેમને ન તો કાંઈ ભય રહેશે અને ન તો તેઓ ઉદાસ થશે.

يَأْتِيهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُمْ مُؤْمِنِينَ ﴿٤٨﴾

(૨૭૮) અચ ઈમાન લાવનારાઓ ! જો તમે મોઅમીન હો તો અલ્લાહથી ડરીને ચાલો અને રિબાઅમાંથી બાકી રહેલું છોડી દો.

فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۗ وَإِن تُبْتِغُوا فَلَکُمْ رُءُوسُ أَمْوَالِکُمْ ۗ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ ﴿٤٩﴾

(૨૭૯) પછી જો તમે તેમ ન કરો તો અલ્લાહ તથા તેના રસૂલ સાથે લડવા તૈયાર થઈ જાઓ, અને જો તમે તૌબા કરી લો તો તમને તમારી મૂળ

રકમ મળશે, ન તમે અન્યાય કરો ન તમારા પર અન્યાય કરવામાં આવે.

وَإِنْ كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۗ وَأَنْ تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ ﴿٣٨﴾

(૨૮૦) અને જો તે (દેવાદાર) તંગદસ્ત હોય તો (તેનો) સારો સમય (આવે ત્યાં) સુધીની મોહલત આપવી; અને જો તમે (અસલ લેણું પણ) દાન તરીકે જતું કરો તો તે તમારા માટે વધુ સારું છે અગર તમે જાણતા હો તો.

وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَىٰ اللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ﴿٣٩﴾

(૨૮૧) અને તે દિવસથી ડરો કે જે દિવસે અલ્લાહની હજૂરમાં તમો પાછા ફેરવવામાં આવશો; પછી દરેક જણને તેની કમાણીનો પૂરેપૂરો બદલો મળશે અને તેમના ઉપર અન્યાય કરવામાં આવશે નહિ.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَدَايَنْتُمْ بِدِينٍ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى فَاكْتُبُوهُ ۗ وَلْيَكْتُب بَيْنَكُمْ كَاتِبٌ بِالْعَدْلِ ۗ وَلَا يَأْب كَاتِبٌ أَنْ يَكْتُبَ كَمَا عَلَّمَهُ اللَّهُ فَلْيَكْتُبْ ۗ وَلْيُمْلِلِ الَّذِي عَلَيْهِ الْحَقُّ وَلْيَتَّقِ اللَّهَ رَبَّهُ وَلَا بِيْعْهُ مِنْهُ شَيْئًا ۗ فَإِنْ كَانَ الَّذِي عَلَيْهِ الْحَقُّ سَفِيهًا أَوْ ضَعِيفًا أَوْ لَا يَسْتَطِيعُ أَنْ يُمْلَ

هُوَ فُلَيْهَلٌ وَلِيَّهُ بِالْعَدْلِ ط وَاسْتَشْهِدُوا شَهِيدَيْنِ مِنْ
رِجَالِكُمْ ء فَإِنْ لَمْ يَكُونَا رَجُلَيْنِ فَرَجُلٌ وَامْرَأَتْنِ مِنْ
تَرْضَوْنَ مِنَ الشُّهَدَاءِ أَنْ تَضِلَّ إِحْدَاهُمَا فَتُذَكِّرَ إِحْدَاهُمَا
الْأُخْرَى ط وَلَا يَأْبُ الشُّهَدَاءُ إِذَا مَا دُعُوا ط وَلَا تَسْمَعُوا أَنْ
تَكْتُبُوهُ صَغِيرًا أَوْ كَبِيرًا إِلَىٰ آجَلِهِ ط ذَلِكَمْ أَقْسَطُ عِنْدَ اللَّهِ
وَأَقْوَمُ لِلشَّهَادَةِ وَأَدْنَىٰ أَلَّا تَرْتَابُوا إِلَّا أَنْ تَكُونَ تِجَارَةً
حَاضِرَةً تُدِيرُونَهَا بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَلَّا
تَكْتُبُوهَا ط وَأَشْهِدُوا إِذَا تَبَايَعْتُمْ ص وَلَا يُضَارَّ كَاتِبٌ وَلَا

شَهِيدٌ ۖ وَإِنْ تَفَعَّلُوا فَإِنَّهُ فَسُوقٌ بِكُمْ ط وَاتَّقُوا اللَّهَ ط
وَيُعَلِّمُكُمُ اللَّهُ ط وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ﴿٣٧٢﴾

(૨૮૨) અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે કોઈ ઠરાવેલી મુદત માટે પરસ્પર કરજની લેવડદેવડ કરો તો તે લખી લ્યો; અને એક લખનાર તમારી વચ્ચે ન્યાયસર લખે, અને લખનાર લખવા માટે ઈન્કાર કરે નહિ બલકે જેવી રીતે અલ્લાહે તેને શીખવ્યું છે તેવીજ રીતે લખી નાખે, અને જે કરજ લેનાર હોય તે લખાવતો જાય અને તેની માટે જરૂરી છે કે અલ્લાહથી ડરીને લખાવે અને કરજ આપનારનો કોઈ હક ઓછો કરે નહિ; પછી જો તે કરજ લેનાર કમઅક્કલ અથવા કમજોર હોય અને

તે લખાવી શકતો ન હોય તો તેનો વાલી
ન્યાયસર લખાવે; અને તમારામાંથી બે પુરૂષોને
સાક્ષી રાખો, પછી જો બે પુરૂષો (હાજર) ન હોય તો
એક પુરૂષ અને બે સ્ત્રીઓ જે તમે સાક્ષી માટે
પસંદ કરો તેને સાક્ષી બનાવો કે જેથી તે માંહેની
એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવે; અને
(જ્યારે) તે સાક્ષીઓને (હાકેમો સામે સાક્ષી માટે)
બોલાવવામાં આવે ત્યારે (હાજર થવાને) તેઓ
ઈનકાર કરે નહિ; અને તમે નાના કે મોટા
મામલામાં (પણ કરજની) મુદત સુધ્યાં લખવાને
આગસ કરો નહિ; આ અલ્લાહ પાસે વધુ ન્યાયસર
છે અને પુરાવા (માટે)ની વધારે સબળ સાબિતી છે

અને આ વાતને વધુમાં વધુ પાસે છે કે તમને (પાછળથી) શંકા ઉત્પન્ન થાય નહિ, સિવાય કે જ્યારે રોકડ (નાણાની) લેવડેવડ હોય જે તમે માંહોમાંહે કરો તે કદાચને તમે લખો નહિ તો તે માટે તમારા ઉપર કાંઈ દોષ નથી; અને જે વેળા તમે આપસમાં લેવડેવડ કરો ત્યારે (પણ) સાક્ષીઓ રાખો, અને લખનાર તથા સાક્ષીને કાંઈ હાનિ પહોંચાડવામાં આવે નહિ; અને (છતાંય) જો તમે તેમ કરશો તો નિસંશય તમોએ નાફરમાની કરી કહેવાશે; અને અલ્લાહથી ડરો; અને અલ્લાહ તમને (પોતાની આજ્ઞા) શીખવાડે છે; અને અલ્લાહ દરેક વસ્તુની સંપૂર્ણ જાણ રાખે છે.

وَإِنْ كُنْتُمْ عَلَىٰ سَفَرٍ وَلَمْ تَجِدُوا كَاتِبًا فَرِهْنَ مَقْبُوضَةً ۗ
 فَإِنْ أَهْمَنَّ بَعْضُكُم بَعْضًا فَلْيُؤَدِّ الَّذِي أُؤْتِمِنَ أَمَانَتَهُ وَلْيَسْتَقِ
 اللَّهُ رَبَّهُ ۗ وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ۗ وَمَنْ يَكْتُمْهَا فَإِنَّهُ آثَمُ
 قَلْبُهُ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ ۝۳۴

(૨૮૩) અને જો તમે મુસાફરીમાં હો અને કોઈ
 લખનાર ન મળે તો (કરજ લેનાર પાસે જે વસ્તુ
 હાજર હોય) તે ગીરવી (રાખી) લેવામાં આવે; પણ
 જો તમારામાંથી એક (પક્ષ) બીજાને વિશ્વાસપાત્ર
 સમજે તો જેને વિશ્વાસપાત્ર સમજવામાં આવ્યો
 હોય તેને જરૂરી છે કે આપનારની અમાનત પાછી
 સોંપી દે અને અલ્લાહથી કે જે તેનો પરવરદિગાર

છે ડરે; અને તમે પુરાવાને સંતાડો નહિ; અને જે તે (પુરાવા)ને સંતાડશે તેનું અંતઃકરણ નિસંશય ગુનેહગાર છે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.

لِلَّهِ مَا فِي السَّمٰوٰتِ وَمَا فِي الْاَرْضِ ط وَاِنْ تَبَدُّوْا مَا فِى
 اَنْفُسِكُمْ اَوْ تَخْفَوْهُ يُحٰسِبُكُمْ بِهٖ اللّٰهُ ط فَيَغْفِرُ لِمَنْ يَّشَآءُ
 وَيُعَذِّبُ مَنْ يَّشَآءُ ط وَاللّٰهُ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيْرٌ ﴿٣٨٣﴾

(૨૮૪) જે કાંઈ આકાશોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે અલ્લાહનું જ છે; અને જે કાંઈ તમારા અંતઃકરણોમાં છે તે તમે જાહેર કરો યા સંતાડો (પણ) અલ્લાહ (તો) તેનો હિસાબ તમારી

પાસેથી લેશે; પછી જેને યાહશે માફ કરી દેશે અને જેને યાહશે શિક્ષા કરશે; અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવનાર છે.

أَمِنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالْمُؤْمِنُونَ ط كُلُّ أَمِنَ
 بِاللَّهِ وَمَلِكِيَّتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ ق لَا نَفَرِقُ بَيْنَ أَحَدٍ مِّنْ
 رُّسُلِهِ ق وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ
 الْمَصِيرُ ﴿٢٨٥﴾

(૨૮૫) (અમારો) રસૂલ (મોહમ્મદ સ.અ.વ.) તેના પર ઈમાન લાવ્યો છે જે તેના પર પરવરદિગાર તરફથી ઉતારવામાં આવ્યું છે. અને મોઅમીનો (પણ); તેઓ સઘળા અલ્લાહ પર તથા તેના

ફરિશ્તાઓ પર તથા તેની ક્રિતાબો પર તથા તેના
 રસૂલો પર ઈમાન લાવ્યા છે; (એમ કહીને કે) અમે
 તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે કાંઈ ભેદભાવ
 રાખતા નથી; અને તેઓ વળી એમ પણ કહે છે કે
 અમોએ સાંભળ્યું તથા હુકમ માથે ચઢાવ્યો, અથ
 અમારા પરવરદિગાર ! અમે તારીજ ક્ષમા યાહીએ
 છીએ અને (અમારું) તારીજ તરફ પાછું ફરવાનું છે.

لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۗ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا
 مَا كَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا ۗ رَبَّنَا
 وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِنْ قَبْلِنَا ۗ
 رَبَّنَا وَلَا تَحْمِلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۗ وَاعْفُ عَنَّا ۗ وَاعْفِرْ

لَنَا وَارْحَمْنَا إِنَّتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ
الْكُفْرِينَ ﴿٣٨٩﴾

(૨૮૬) અલ્લાહ કોઈ નફસ (વ્યક્તિ)ને તેના ગજા ઉપરાંત તકલીફ આપતો નથી, તેણે જે સારી કમાઈ કરી છે તેનો (નફો) તેનાજ માટે છે અને જે બૂરી કમાઈ કરી છે તેનો ગેરલાભ પણ તેનાજ માટે છે; અથ અમારા પરવરદિગાર ! જો અમે ભૂલી જઈએ અથવા કોઈ ચૂક કરી બેસીએ તો તે માટે અમને પકડજે નહિ, અને અથ અમારા પરવરદિગાર ! અમારા પર એવો બોજો નાખજે નહિ જેવો કે અમારી પહેલાં થઈ જનારાઓ પર નાખ્યો હતો, અને અથ અમારા પરવરદિગાર !

અને અમારાથી એટલું ન ઊંચકાવ કે જે
(ઊંચકવા)ની અમારામાં શક્તિ નથી, અને
અમારાથી દરગુજર કર, અને અમને માફ કરી દે,
અને અમારા પર દયા કર, તું (જ) અમારો માલિક
છે માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી સહાય
કર.

સુરએ આલે ઈમરાન / سورة آل عمران

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી (શરૂ કરું છું) જે ઘણો મહેરબાન
(કૃપાળુ), બહુજ રહેમ (દયા) વાળો છે.

اللَّهُ ۝

(૧) અલિફ. લામ. મીમ.

اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ ۖ الْحَيُّ الْقَيُّومُ ۝

(૨) અલ્લાહ તે છે કે જેના સિવાય અન્ય કોઈ
પૂજ્ય (બંદગીને લાયક) નથી, તે હંમેશ જીવંત
(અને) સ્વબળથી કાયમ રહેલો છે.

نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ وَأَنْزَلَ
التَّوْرَةَ وَالْإِنْجِيلَ ۝

(3) તેણે તારા ઉપર આ કિતાબ સત્યતાપૂર્વક ઉતારી છે જે તેની પહેલા ઉતરેલી (ઈલાહી) કિતાબોને ટેકો આપે છે અને તેણે તે અગાઉ લોકોની હિદાયત માટે તૌરેત તથા ઈન્જીલ ઉતારી હતી.

مَنْ قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنْزَلَ الْفُرْقَانَ ۝ إِنَّ الَّذِينَ كَفَرُوا
بِآيَاتِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۝ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ ۝

(૪) અને કુરકાન (કુરઆન) પણ તેણેજ ઉતાર્યું; બેશક જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઈન્કાર

કરે છે તેમના માટે સખ્ત શિક્ષા છે; અને અલ્લાહ જબરદસ્ત બદલો લેનાર છે.

إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ ٥

(૫) નિસંશય અલ્લાહ એજ છે કે જેનાથી જમીન તથા આકાશની કોઈપણ વસ્તુ છૂપી નથી.

هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ٦ لَا إِلَهَ إِلَّا

هُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٦

(૬) એજ તે છે કે જે માના ગર્ભાશયમાં જેવી યાહે છે તેવી તમારી સુરતો બનાવી દે છે; તે જબરદસ્ત હિકમતવાળા સિવાય અન્ય કોઈ પૂજ્ય નથી.

هُوَ الَّذِي أَنْزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُحْكَمَاتٌ هُنَّ أُمُّ
 الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ
 فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ
 وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ
 آمَنَّا بِهِ ۗ كُلٌّ مِّنْ عِنْدِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو
 الْأَلْبَابِ ⑥

(૭) (અથ રસૂલ) એજ તે (અલ્લાહ) છે કે જેણે
 તારા ઉપર આ કિતાબ ઉતારી છે જેની કેટલીક
 આયતો સાફ (સ્પષ્ટ અને એક અર્થી) છે અને એજ
 આયતો કિતાબનું મૂળ છે બીજી બહુઅર્થી છે; હવે

જે લોકોના અંતઃકરણોમાં અવળાઈ છે તેઓ તે (કિતાબ)માંની બહુઅર્થી આયતોને અનુસરે છે (અને તે કેવળ) ફિત્નો ફેલાવવાના હેતુથી, અને તેનો અર્થ (પોતાની) ઈચ્છા મુજબ કરવાના હેતુથી, જો કે તેનો (ખરો) અર્થ અલ્લાહના અને તેમના સિવાય કે જેઓ જ્ઞાનમાં પ્રવિણ છે અન્ય કોઈ જાણતું નથી; અને તે (પ્રવિણ લોકો) કહે છે કે અમે તેના પર ઈમાન લાવ્યા, દરેક (દાખલા તથા આજ્ઞાઓ) અમારા પરવરદિગાર તરફથી છે, અને બુદ્ધિશાળીઓ સિવાય અન્ય કોઈ બોધ ગ્રહણ કરતા નથી.

رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِنْ لَدُنْكَ
رَحْمَةً ۖ إِنَّكَ أَنْتَ الْوَهَّابُ ﴿٨﴾

(૮) અથ અમારા પરવરદિગાર! અમને સન્માર્ગે
દોર્યા પછી અમારા અંતઃકરણોને આડે માર્ગે જવા
દેજ નહિ અને અમને તારી પાસેથી રહેમત અર્પણ
કર, બેશક તું સૌથી મોટો (રહેમત) અર્પણ કરનાર
છે.

رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ ۗ لَا رَيْبَ فِيهِ ۗ إِنَّ اللَّهَ لَا
يُخْلِفُ الْمِيعَادَ ﴿٩﴾

(૯) અથ અમારા પરવરદિગાર ! નિસંશય તું તે
(કયામત)ના દિવસે માણસોને ભેગા કરનાર છે કે

જે (દિવસ)ના વિષે કાંઈજ શંકા નથી (ત્યારે અમારા પર કૃપાદ્રષ્ટિ રાખજો); બેશક અલ્લાહ વચન ભંગ કરતો નથી.

إِنَّ الَّذِينَ كَفَرُوا لَنْ تُغْنِي عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ
مِّنَ اللَّهِ شَيْئًا ۗ وَأُولَٰئِكَ هُمُ وَقُودُ النَّارِ ۝

(૧૦) બેશક જેઓ ઈમાન લાવ્યા નથી તેમની સંપત્તિ તથા સંતતિ તેમને અલ્લાહ (ની શિક્ષા)થી જરાય બચાવી શકશે નહિ અને તેઓ જ જહન્નમનું બળતણ બનશે;

كَذَابٍ أَلِيٍّ فِرْعَوْنُ ۗ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۗ كَذَّبُوا بِآيَاتِنَا ۗ
فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ ۝

(૧૧) ફિરઔનવાળા તથા તેમની પહેલાઓની જેમ; તેમણે પણ અમારી આયતો જૂઠલાવી હતી, પછી અલ્લાહે તેમના ગુનાહોના બદલે તેમની ધરપકડ કરી; અને અલ્લાહ સખત સજા કરનાર છે.

قُلْ لِلَّذِينَ كَفَرُوا سَتْغَلِبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ط
وَبِئْسَ الْمِهَادُ ⑫

(૧૨) (અય રસૂલ) જેઓ ઈમાન લાવ્યા નથી તેઓને કહે કે તરતમાંજ તમે (મુસ્લિમોના મુકાબલામાં) પરાજય પામશો તથા તમે જહન્નમ તરફ હાંકી લઈ જવામાં આવશો; અને તે એક ઘણું જ ખરાબ રહેઠાણ છે.

قَدْ كَانَ لَكُمْ آيَةٌ فِي فِئَتَيْنِ الْتَقَتَا فِئَةٌ تُقَاتِلُ فِي سَبِيلِ
 اللَّهِ وَأُخْرَى كَافِرَةٌ يَرَوْنَهُمْ مِثْلَيْهِمْ رَأَى الْعَيْنُ ط وَاللَّهُ يُؤَيِّدُ
 بِنَصْرِهِ مَنْ يَشَاءُ ط إِنَّ فِي ذَلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ ﴿١٣﴾

(૧૩) ખચીતજ તમારા સમજવા માટે તે બે
 (વિરોધી) ટોળાના સબંધમાં (કે) જેઓ (જંગે
 બદરમાં) સામસામા થયા (હતા તેમાં રસૂલની
 સચ્ચાઈનો) એક મોઅજિઓ હતો; (અર્થાત) એક
 ટોળું તો અલ્લાહના માર્ગમાં લડતું હતું અને બીજું
 ઈન્કાર કરનારું હતું કે જેમને દેખતી આંખે તે
 (મુસલમાનો) પોતાના કરતાં બમણાં જોઈ રહ્યા
 હતા (પણ અલ્લાહે મુસલમાનોનેજ વિજય

આપ્યો); અને અલ્લાહ પોતાની મદદથી જેને યાહે છે તેને બાળવાન બનાવે છે; બેશક આ (બનાવ)માં (અંતર) ચક્ષુ ધરાવનારાઓ માટે બોધપાઠ છે.

زَيْنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوَاتِ مِنَ النِّسَاءِ وَالْبَنِينَ
وَالْقَنَاطِيرِ الْمُقَنْطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ
الْمُسَوَّمَةِ وَالْأَنْعَامِ وَالْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۗ
وَاللَّهُ عِنْدَهُ حُسْنُ الْمَبَٰئِ ۝۱۴

(૧૪) સ્ત્રીઓ અને બાળકો અને સોના ચાંદીનો ભેગો કરેલો ખજાનો અને ચુનંદા ઘોડા અને ઢોરઢાંખર અને ખેતીવાડી એ (સઘળી વસ્તુઓ)ની ઈચ્છાઓની માયા લોકોની નઝરમાં સુશોભિત

બનાવી દેવામાં આવી છે; (જો કે) આ વસ્તુઓ
(નાશવંત) જિંદગીના સાધનો છે, અને ઉત્તમ
રહેઠાણ તો અલ્લાહનીજ પાસે છે.

قُلْ أَوْ نَبِّئُكُمْ بِخَيْرٍ مِّنْ ذَلِكُمْ ط لِلَّذِينَ اتَّقَوْا عِنْدَ رَبِّهِمْ
جَنَّتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خُلِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُّطَهَّرَةٌ
وَرِضْوَانٌ مِّنَ اللَّهِ ط وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ ⑮

(૧૫) (અથ રસૂલ !) કહે કે શું હું તમને એ કરતાંય
વધુ સારી વસ્તુઓની જાણ કરી દઉં? જેમણે
પરહેઝગારી ગ્રહણ કરી છે તેમના માટે તેમના
પરવરદિગાર પાસે બગીચા છે જેમની હેઠળ
નદીઓ વહેતી રહે છે જેમાં તેઓ હંમેશને માટે

રહેનાર છે; (તેમાં) પાક સાફ જોડાં છે અને અલ્લાહની પ્રસન્નતા (પણ) છે અને અલ્લાહ (સર્વ) બંદાઓને નિહાળનાર છે.

الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا أَمْنَا فَأَغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقَنَا
عَذَابَ النَّارِ ﴿١٣﴾

(૧૬) જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર ! બેશક અમે ઈમાન લાવ્યા છીએ માટે અમારા ગુનાહ માફ કરી દે અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવી લે.

الصَّابِرِينَ وَالصَّادِقِينَ وَالْقَانِتِينَ وَالْمُنْفِقِينَ
وَالْمُسْتَغْفِرِينَ بِالْأَسْحَارِ ﴿١٤﴾

(૧૭) (તેઓ) ધીરજ ધરનારા તથા સત્ય કહેનારા તથા અલ્લાહની આજ્ઞા માનનારા તથા અલ્લાહના માર્ગમાં ખર્ચ કરનારા અને પ્રભાતના સમયે ક્ષમા યાચનારા (છે.)

شَهِدَ اللهُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ ۖ وَالْمَلِكُ وَالْعَلِيمُ قَائِمًا
بِالْقِسْطِ ۗ لَا إِلَهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ ۝١٨

(૧૮) અલ્લાહ સાક્ષી આપે છે કે તેના (પોતાના) સિવાય અન્ય કોઈ પૂજ્ય નથી, અને તે (સર્વ સૃષ્ટિને) ન્યાયથી કાયમ રાખી રહ્યો છે (તેવી જ સાક્ષી) સઘળા ફરિશ્તાઓ તથા જ્ઞાનીઓ (પણ પુરે છે); તે જબરદસ્ત હિકમતવાળા (અલ્લાહ) સિવાય અન્ય કોઈ પૂજ્ય નથી.

إِنَّ الدِّينَ عِنْدَ اللَّهِ الْإِسْلَامُ ۗ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا
 الْكِتَابَ إِلَّا مِنْ بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۗ وَمَنْ
 يَكْفُرْ بِآيَاتِ اللَّهِ فَإِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ ①

(૧૯) નિસંશય પસંદ કરેલો દીન તો અલ્લાહની
 પાસે ઈસ્લામ જ છે; અને જેમને (તૌરેત ઈન્જીલ
 વિગેરે) કિતાબ આપવામાં આવી હતી તેમણે (આ
 પસંદ કરેલા દીનમાં) મતભેદ કર્યો નહિ પણ
 તેમણે જ્ઞાન આવી ગયા પછી (અને તે માત્ર)
 આપસની ઈર્ષાના કારણેજ; અને જે કોઈ
 અલ્લાહની આયતોનો ઈન્કાર કરશે (તે તે જાણી
 લે કે) બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે.

فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّهِ وَمَنِ اتَّبَعَنِ ط وَقُلْ
 لِلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ ءَأَسْلَمْتُمْ ط فَإِنْ أَسْلَمُوا
 فَقَدْ اهْتَدَوْا ء وَإِنْ تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلْغُ ط وَاللَّهُ بَصِيرٌ
 بِالْعِبَادِ ۝

(૨૦) (અચ રસૂલ !) છતાં જો તેઓ તારી સાથે તકરાર કરે તો કહે કે મેં તથા મારા અનુયાયીઓએ અલ્લાહની સામે (તાબેદારીનું) શીશ નમાવી દીધું છે; અને તે લોકોથી કે જેમને કિતાબ આપવામાં આવી છે (તેમને) તથા અભણો (મક્કાવાસીઓ) ને પૂછી લે કે શું તમે પણ ઈમાન લાવ્યા ? પછી જો તેઓ ઈસ્લામ લઈ આવે તો

ખરેજ તેમણે સન્માર્ગ મેળવ્યો, અને જો પાછા ફરે તો તારા શિરે તો માત્ર (અલ્લાહનો) સંદેશો પહોંચાડવાનું છે; અને અલ્લાહ સર્વ બંદાઓને નિહાળનાર છે.

إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيَّ بِغَيْرِ حَقٍّ ۖ
وَيَقْتُلُونَ الَّذِينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النَّاسِ ۖ فَبِئْسَ لَهُمْ
بِعَذَابٍ أَلِيمٍ ﴿٣١﴾

(૨૧) નિસંશય જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઈન્કાર કરે છે અને નબીઓને નાહક મારી નાખે છે અને માણસોમાંથી તેઓને (પણ) મારી નાખે છે કે જેઓ અદલ ઈન્સાફની આજ્ઞા કરે છે તો તેઓને

(અય રસૂલ! તું) દુઃખદાયક શિક્ષાની ખુશખબર
સંભળાવ.

أُولَئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا
لَهُمْ مِنْ نَّاصِرِينَ ﴿٢٢﴾

(૨૨) તેઓ એજ (હતભાગી લોકો) છે કે જેમના
કર્મો આલોક તથા પરલોકમાં વ્યર્થ જશે, અને
તેમનો કોઈપણ મદદગાર થશે નહિ.

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أَوْتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَى
كِتَابِ اللَّهِ لِيَحْكَمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّى فَرِيقٌ مِّنْهُمْ وَهُمْ
مُّعْرِضُونَ ﴿٢٣﴾

(૨૩) (અય રસૂલ!) શું તું તે લોકો (યહૂદી આલિમો)ને નથી જોયાં કે જેમને (અલ્લાહની) કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે? જ્યારે તેમને અલ્લાહની કિતાબ (તૌરેત) તરફ બોલાવવામાં આવે છે કે તે તૌરેત તેમની વચ્ચે ફેંસલો કરે ત્યારે તેઓ માંહેનું એક ટોળું મોઢું ફેરવી પાછું ચાલ્યું જાય છે.

ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لَنْ نَّمَسَّ النَّارُ اِلَّا اَيَّامًا مَّعْدُوْدٰتٍ
وَعَرَّهٖمْ فِيْ دِيْنِهِمْ مَّا كَانُوْا يَفْتَرُوْنَ ﴿۲۳﴾

(૨૪) આ એ કારણે કે તે લોકો કહે છે કે આગ અમને તો ગણ્યા ગાંઠ્યા દિવસો સિવાય હરગિઝ અડકશે નહિ, અને જે અસત્ય તેઓ જોડી કાઢતા

હતા તે (અસત્ય) જ તેમને તેમના ધર્મ સબંધી
છેતર્યા છે.

فَكَيْفَ إِذَا جَمَعْتَهُمْ لِيَوْمٍ لَا رَيْبَ فِيهِ تَفَّ وَوَفَّيْتُ كُلَّ نَفْسٍ
مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ﴿٢٥﴾

(૨૫) પછી જ્યારે તે દિવસે કે જે દિવસ વિષે કાંઈ
પણ શંકા નથી અમે તેમને ભેગા કરી લઈશું ત્યારે
તેમની કેવી (દશા) થશે, અને દરેક જણને તેની
કમાઈનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને
તેમના પર (કોઈ પ્રકારનો) ઝુલ્મ કરવામાં આવશે
નહિ.

قُلِ اللَّهُمَّ مَلِكُ الْمَلِكِ تُؤْتِي الْمَلِكَ مِنْ تَشَاءُ وَتَنْزِعُ الْمَلِكَ
 مِنْ تَشَاءُ وَتُعِزُّ مَنْ تَشَاءُ وَتُنِزِّلُ مَنْ تَشَاءُ بِبِيَدِكَ الْخَيْرُ ط
 إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿٤٦﴾

(૨૬) (અય રસૂલ!) કહે કે અય અલ્લાહ! અય સલ્તનતના માલિક! જેને તું યાહે છે સલ્તનત આપે છે, જેની યાહે છે (તેની) સલ્તનત ખૂંચવી લે છે અને જેને તું યાહે છે ઈજ્જત આપે છે અને જેને યાહે છે તેને તું હલકો પાડે છે; જે કાંઈ પણ તું કરે છે તે સાફ જ કરે છે; બેશક તું દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવનાર છે.

تُوجَّعُ اللَّيْلُ فِي النَّهَارِ وَتُوجَّعُ النَّهَارُ فِي اللَّيْلِ ۚ وَتُخْرِجُ الْحَيَّ مِنَ
الْبَيْتِ وَتُخْرِجُ الْبَيْتَ مِنَ الْحَيِّ ۚ وَتَرزُقُ مَنْ تَشَاءُ بِغَيْرِ
حِسَابٍ ﴿٢٤﴾

(૨૭) તું રાત્રિને દિવસમાં ભેળવી નાખે છે અને દિવસને રાત્રિમાં ભેળવી નાખે છે, તું મરણ પામેલાઓમાંથી જીવતાઓને કાઢી લાવે છે અને જીવતાઓમાંથી મરેલાઓને કાઢે છે, અને જેને યાહે છે બેહિસાબ રોજી પહોંચાડે છે.

لَا يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكٰفِرِيْنَ اَوْلِيَاءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِيْنَ ؕ
 وَمَنْ يَفْعَلْ ذٰلِكَ فَلَيْسَ مِنَ اللّٰهِ فِيْ شَيْءٍ اِلَّا اَنْ تَتَّقُوا مِنْهُمْ
 تُقٰةً ۗ وَيُحٰذِرْكُمْ اللّٰهُ نَفْسَهُ ۗ وَاِلَى اللّٰهِ الْمَصِيْرُ ﴿٢٨﴾

(૨૮) મોઅમીનો મોઅમીનોને મૂકી નાસ્તિકોને
 મિત્ર ન બનાવે, અને જે એમ કરશે તો તેનો
 અલ્લાહ સાથે કાંઈ સબંધ નથી સિવાય એ
 હાલતમાં કે તમે તેમના (તરફ)થી કોઈ જાતનો
 ભય રાખતા હો, અને અલ્લાહ તમને પોતાનાથી જ
 ડરવાનું ફરમાવે છે; અને (સર્વનું) અલ્લાહ તરફજ
 પાછું ફરવાનું છે.

قُلْ إِنْ تَحْفُوا مَا فِي صُدُورِكُمْ أَوْ تُبْدُوا وَعَلَمَهُ اللَّهُ ط وَيَعْلَمُ

مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الْأَرْضِ ط وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿٢٩﴾

(૨૯) (અચ રસૂલ!) કહે કે જે કાંઈ તમારા અંતઃકરણોમાં છે તે યાહે સંતાડો યા તે જાહેર કરો અલ્લાહ તે (સઘળું) જાણે છે; અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે પણ જાણે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવનાર છે.

يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا ۖ وَمَا عَمِلَتْ

مِنْ سُوءٍ ۖ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهَا أَمَدًا بَعِيدًا ط وَيُحْذِرُكُمْ

اللَّهُ نَفْسَهُ ط وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ ﴿٣٠﴾

(30) (અને તે દિવસને યાદ રાખો કે) જે દિવસે દરેક શખ્સ જે કાંઈ તેણે (દુનિયામાં) નેકી કરી છે અને જે કાંઈ બદી કરી છે તેને હાજર (થયેલી) જોશે, (ત્યારે બદી કરનાર) ઈચ્છશે કે તેની અને તે દિવસ વચ્ચે કદાચને એક લાંબી મુદત હોત (તો કેવું સારું); અને અલ્લાહ તમને તેનાથી ડરતા રહેવાનું ફરમાવે છે; અને અલ્લાહ સર્વે બંદાઓ પર અતિ મહેરબાન છે.

قُلْ إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ
لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ ﴿٣١﴾

(31) (અથ રસૂલ!) કહે કે જો તમે અલ્લાહના બંદાઓ હો તો મારા પગલે ચાલો કે જેથી અલ્લાહ

તમને યાહે અને તમારા ગુનાહ માફ કરે; અને અલ્લાહ મહાન માફ કરનાર (અને) દયા કરનાર છે.

قُلْ أَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ ۚ فَإِنْ تَوَلَّوْا فَإِنَّ اللَّهَ لَا يُحِبُّ
الْكَافِرِينَ ﴿٣٣﴾

(૩૨) (અય રસૂલ!) કહે કે તમે અલ્લાહ તથા રસૂલની આજ્ઞા માનો, પછી જો તેઓ મોઢ ફેરવી લે તો નિસંશય અલ્લાહ આજ્ઞા નહિ માનનારાઓને (હરગિઝ) દોસ્ત રાખતો નથી.

إِنَّ اللَّهَ اصْطَفَىٰ آدَمَ وَنُوحًا وَآلَ إِبْرَاهِيمَ وَآلَ عِمْرَانَ عَلَى
الْعَالَمِينَ ﴿٣٣﴾

(૩૩) નિસંશય અલ્લાહે આદમ તથા નૂહને અને ઈબ્રાહીમના વંશજોને તથા ઈમરાનના વંશજોને સઘળી દુનિયાવાળાઓ ઉપર ચૂંટી કાઢયા (છે);

ذُرِّيَّةً بَعْضُهَا مِنْ بَعْضٍ ۖ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴿٣٣﴾

(૩૪) કેટલાક એકબીજાના વંશમાંથી અને અલ્લાહ મહાન સાંભળનાર (અને) જાણનાર છે.

إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۗ إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ ﴿٣٥﴾

(૩૫) (અય રસૂલ ! તે સમયને યાદ કર) જ્યારે ઈમરાનની સ્ત્રી (હન્ના) એ (અલ્લાહને) અરજ કરી કે અય મારા પરવરદિગાર ! નિસંશય મારા પેટમાં

જે (બાળક) છે તેને મેં (સંસારી જંજાળોમાંથી) મુક્ત કરી તારા માટે અર્પણ કરવાની માનતા કરી છે માટે તું મારા તરફથી (તે) સ્વીકારી લે, બેશક તું જ મહાન સાંભળનાર (અને) જાણનાર છે.

فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ اِنِّیْ وَضَعْتُهَا اُنْثٰی ۗ وَاللّٰهُ اَعْلَمُ بِمَا وَضَعْتَ ۗ وَلَیْسَ الذَّکَرُ کَالْاُنْثٰی ۚ وَاِنِّیْ سَمَّیْتُهَا مَرْیَمَ ۗ وَاِنِّیْ اَعِیْذُهَا بِکَ وَذُرِّیَّتَهَا مِنَ الشَّیْطٰنِ الرَّجِیْمِ ﴿۳۱﴾

(૩૬) પછી જ્યારે તેણીએ તે (બાળક)ને જન્મ આપ્યો ત્યારે (આશ્ચર્યથી) કહેવા લાગી કે અય મારા પરવરદિગાર ! (હવે હું શું કરું) મેં તો આ છોકરી જણી છે; જો કે અલ્લાહ સારી પેઠે જાણતો

હતો કે તેણીએ શું જાણ્યું છે; અને(વળી તેણીએ એ પણ અરજ કરી કે) છોકરો છોકરીના જવો હતો નથી, અને મેં તેનું નામ મરિયમ પાડ્યું છે નિસંશય હું તેને તથા તેના વંશને પથ્થરથી મારેલા (લાનત પામેલા) શેતાન (ના ફરેબ)થી બચાવવા તારી પનાહમાં આપું છું.

فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ ۖ وَأَنْبَتَهَا نَبَاتًا حَسَنًا ۖ وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ ۖ وَجَدَ عِنْدَهَا رِزْقًا ۖ قَالَ يَمْرِئُمُ آتَىٰ لَكَ هَذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِنْدِ اللَّهِ ۖ إِنَّ اللَّهَ يَرْزُقُ مَنْ يَشَاءُ بِغَيْرِ حِسَابٍ ﴿۳۱﴾

(૩૭) ત્યારે તેના પરવરદિગારે તેનો માનપૂર્વક સ્વીકાર કર્યો અને તે (બાળા)ને સારી પેઠે ઉછેરી અને અલ્લાહે તેણીને ઝકરીઆ (નબી)ના (વાલીપણામાં) હવાલે કરી દીધી; જ્યારે જ્યારે ઝકરીયા તે બાળા (મરિયમને જોવા માટે) મસ્જિદમાં દાખલ થતો ત્યારે ત્યારે તેણીની પાસે કોઈ ખાવાની વસ્તુ (હાજર) જોતો, (આથી) તે (આશ્ચર્ય પામી) પૂછતો કે અય મરિયમ! આ વસ્તુઓ તારી પાસે ક્યાંથી? તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે; બેશક અલ્લાહ યાહે તેને બેહિસાબ રોજી અર્પણ કરે છે.

هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُ ۖ قَالَ رَبِّ هَبْ لِي مِنْ لَدُنْكَ ذُرِّيَّةً
طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ ﴿٣٨﴾

(38) (આ જવાબ સાંભળી) ઝકરીયાએ ત્યાંજ પોતાના પરવરદિગાર પાસે દુઆ કરી, અને અરજ કરી કે અથ મારા પરવરદિગાર ! મને પણ તારી પાસેથી નેક વંશ (પુત્ર) અર્પણ કર, નિસંશય તું દુઆનો મહાન સાંભળનાર છે.

فَنَادَتْهُ الْمَلِكَةُ وَهُوَ قَائِمٌ يُصَلِّي فِي الْمِحْرَابِ ۗ أَنَّ اللَّهَ
يُبَشِّرُكَ بِغُلَامٍ مُصَدِّقًا بِكَلِمَةٍ مِّنَ اللَّهِ وَسَيِّدًا وَحَصُورًا
وَنَبِيًّا مِّنَ الصَّالِحِينَ ﴿٣٩﴾

(૩૯) હજી તો તે (ઝકરિયા) મસ્જિદમાં (દુઆ કરતો) ઉભો જ હતો (ત્યાં) ફરિશ્તાઓએ તેને અવાજ આપ્યો (અને કહ્યું) કે અલ્લાહ તને યહ્યા (ના પેદા થવા)ની ખુશખબરી આપે છે જે અલ્લાહના કલ્મા (શબ્દ) (અર્થાત ઈસા)ને સત્ય ઠરાવનાર તથા (લોકોનો) સરદાર તથા વાસનાઓથી પાક અને સદાચારી નબીઓમાંહેનો (એક નબી) થશે.

قَالَ رَبِّ اَنِي يَكُونُ لِي غُلْمٌ وَّوَقَدْ بَلَغَنِي الْكِبَرُ وَاْمْرًا تِي
عَاقِرٌ ط قَالَ كَذٰلِكَ اللهُ يَفْعَلُ مَا يَشَاءُ ﴿٣٠﴾

(૪૦) (ઝકરિયાએ) અરજ કરી કે અય મારા પરવરદિગાર! મારે છોકરો કયાંથી થશે જ્યારે કે હું વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયો છું અને મારી પત્ની ગર્ભધારણ કરવાને શક્તિમાન નથી, ફરમાવ્યું કે અલ્લાહ એવી સ્થિતિમાં (પણ) જે ઈચ્છે છે કરી દે છે.

قَالَ رَبِّ اجْعَلْ لِي آيَةً ط قَالَ آيَتُكَ إِلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ
 أَيَّامٍ إِلَّا رَمَزًا ط وَاذْكُرْ رَبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِالْعَشِيِّ
 وَالْإِبْكَارِ ﴿٣١﴾

(૪૧) (ઝકરિયાએ) અરજ કરી કે અય મારા પરવરદિગાર! મારી (ખાત્રી) માટે કોઈ નિશાની

નક્કી કર; ફરમાવ્યું તારી નિશાની આ છે કે તું ત્રણ દિવસ સુધી લોકો સાથે ઈશારા સિવાય વાતચીત કરી શકશે નહિ; અને (તેના આભારમાં) તારા પરવરદિગારને વધુ પ્રમાણમાં યાદ કર અને સાંજ સવાર તેના ગુણ ગાન ગાતો રહે.

وَإِذْ قَالَتِ الْمَلِكَةُ يُمْرِيْمُ إِنَّ اللَّهَ اصْطَفَاكِ وَطَهَّرَكِ
وَاصْطَفَاكِ عَلَى نِسَاءِ الْعَالَمِينَ ﴿۴۲﴾

(૪૨) (અને અય રસૂલ! તે સમયને યાદ કર) જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરીયમ! અલ્લાહે બેશક તને ચૂંટી કાઢી છે અને તને પવિત્ર બનાવી છે અને તને ઝમાનાની સ્ત્રીઓ કરતાં શ્રેષ્ઠ બનાવી છે.

بِمَرْيَمَ اقْنُتِي لِرَبِّكِ وَاسْجُدِي وَارْكَعِي مَعَ الرَّاكِعِينَ ﴿٣٣﴾

(૪૩) માટે અય મરીયમ! (એના આભારમાં) તું તારા પરવરદિગારની ફરમાબરદારી કર અને રુકુઅ તથા સિજદા કરનારાઓની સાથે રુકુઅ (અને સિજદા) કર.

ذٰلِكَ مِنْ اَنْبَاءِ الْغَيْبِ نُوْحِيْهِ اِلَيْكَ ۗ وَمَا كُنْتَ لَدَيْهِمْ اِذْ يُلْقُوْنَ اَقْلَامَهُمْ اِيَّهِمْ يَكْفُلُ مَرْيَمَ ۗ وَمَا كُنْتَ لَدَيْهِمْ اِذْ

يَخْتَصِمُوْنَ ﴿٣٤﴾

(૪૪) (અય રસૂલ!) આ અદ્રષ્ય વાતો (માંહેની એક છે કે જે) અમે તને વહી દ્વારા જણાવીએ છીએ; અને મરીયમની દેખરેખ કોણ કરે એ નક્કી કરવા

માટે તેઓ (નદીમાં) પોતાની કલમો નાખતા હતા ત્યારે તું તેમની પાસે હાજર ન હતો, અને જ્યારે તેઓ (એ વિષે) આપસમાં ઝઘડતા હતા ત્યારે પણ તું તેમની પાસે ન હતો.

إِذْ قَالَتِ الْمَلِكَةُ يُمْرِيْمُ إِنَّ اللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ ۗ
اسْمُهُ الْمَسِيْحُ عِيسَى ابْنُ مَرْيَمَ وَجِيهًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ
وَمِنَ الْمُقَرَّبِينَ ﴿٧٥﴾

(૪૫) (તે સમયને યાદ કર) જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરીયમ! નિસંશય અલ્લાહ તને પોતાના એક કલ્મા (શબ્દ ઈસા)ની ખુશખબર આપે છે જેનું નામ મસીહ, (યાને) મરીયમનો પુત્ર,

ઈસા હશે (જે) આલોક તથા પરલોકમાં માનવંત
અને (અલ્લાહના) નિકટ બંદાઓ માંહેનો થશે:

وَيُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا وَمِنَ الصَّالِحِينَ ﴿٨٥﴾

(૪૬) અને તે લોકો સાથે તે બાળવય (પારણાં)માં
તેમજ વૃદ્ધાવસ્થામાં (પણ સમાન) વાતો કરશે અને
તે સદાચારીઓમાંથી હશે.

قَالَتْ رَبِّ أَنَّى يَكُونُ لِي وَلَدٌ وَلَمْ يَمَسِّنِي بَشَرٌ ط قَالَ
كَذَلِكَ اللَّهُ يُخَلِّقُ مَا يَشَاءُ ط إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ
كُنْ فَيَكُونُ ﴿٨٦﴾

(૪૭) (આ સાંભળી આશ્ચર્યથી તેણીએ) અરજ કરી
કે અય મારા પરવરદિગાર! મને બાળક ક્યાંથી

થશે એવી હાલતમાં કે જ્યારે કોઈ પુરુષ મને અડક્યો પણ નથી ફરમાવ્યું, આવી સ્થિતિમાં પણ અલ્લાહ જે વસ્તુ યાહે છે પેદા કરી દે છે; જ્યારે તે કોઈ મામલાનો નિશ્ચય કરી લે છે ત્યારે તેને માત્ર (એટલું જ) કહી દે છે કે "કુન" (અર્થાત થા) અને તે થઈ જાય છે.

وَيُعَلِّمُهُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَةَ وَالْإِنْجِيلَ ﴿١٣٦﴾

(૪૮) અને (અલ્લાહ) તે (ઈસા)ને કિતાબ તથા હિકમત (સારા નરસાની સમજ) અને તવરેત તથા ઈન્જીલનું શિક્ષણ આપશે.

وَرَسُولًا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ ۖ إِنِّي قَدْ جِئْتُكُمْ بِآيَةٍ مِّن رَّبِّكُمْ ۖ
 إِنِّي أَخْلُقُ لَكُمْ مِّنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ فَأَنْفُخُ فِيهِ فَيَكُونُ
 طَيْرًا بِإِذْنِ اللَّهِ ۗ وَأُبْرِئُ الْكَلْبَةَ وَالْأَبْرَصَ وَأُحْيِي الْمَوْتَىٰ
 بِإِذْنِ اللَّهِ ۗ وَأُنَبِّئُكُمْ بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ ۖ فِي
 بُيُوتِكُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُمْ مُّؤْمِنِينَ ﴿٧٩﴾

(૪૯) અને બની ઈસરાઈલ તરફ એક રસૂલ
 (બનાવી મોકલશે અને તે કહેશે) કે હું તમારા
 પરવરદિગાર તરફથી (મારી નબુવ્વતની) નિશાની
 લઈને આવ્યો છું, હું તમારા માટે પલળેલી માટી
 (માં)થી પક્ષી જેવો આકાર બનાવીશ પછી તેમાં
 ફુંકીશ જેથી તે અલ્લાહના હુકમથી (જીવતું જાગતું)

પક્ષી થઈ જશે, અને હું જન્મથી આંધળા તથા કોઢીયાઓને સાજા કરીશ, અને હું અલ્લાહના હુકમથી મરી ગયેલાઓને સજીવન કરીશ, અને તમે તમારા ઘરોમાં જે કાંઈ ખાઓ (પીઓ) છો તથા જે કાંઈ સંગ્રહ કરો છો તેની તમને જાણ કરી દઈશ; જો તમે મોમીન હો તો નિસંશય તેમાં તમારા માટે (મારી નબુવતની) નિશાની મોજૂદ છે.

وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَةِ وَإِلَّا جَلَّ لَكُمْ بَعْضُ
 الَّذِي حُرِّمَ عَلَيْكُمْ وَجِئْتُكُمْ بِآيَةٍ مِّن رَّبِّكُمْ فَاتَّقُوا اللَّهَ
 وَأَطِيعُوا ۝٥٠

(૫૦) અને (હું એ માટે આવ્યો છું કે) મારી પહેલાંની તૌરેતને સમર્થન આપું અને એ માટે કે કેટલીક વસ્તુઓ કે જે તમારા ઉપર હરામ કરવામાં આવી છે (તેને) તમારા માટે હલાલ ઠરાવું અને તમારા પરવરદિગાર પાસેથી એક નિશાની (મોઅજિઓ) લઈને આવ્યો છું માટે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો.

إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَأَعْبُدُواهُ ط هَذَا صِرَاطٌ مُسْتَقِيمٌ ﴿٥١﴾

(૫૧) બેશક અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમારો પણ પરવરદિગાર છે જેથી તેની જ ઈબાદત કરો; સીધો માર્ગ એજ છે.

فَلَمَّا أَحَسَّ عَيْسَىٰ مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ أَنْصَارِي إِلَى اللَّهِ ط
قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنْصَارُ اللَّهِ ؕ آمَنَّا بِاللَّهِ ؕ وَاشْهَدْ بِأَنَّا
مُسْلِمُونَ ﴿٥٢﴾

(પર) પછી જ્યારે ઈસાએ તેમની તરફથી ઈન્કાર અનુભવ્યો ત્યારે તે બોલ્યો કે અલ્લાહના માર્ગમાં મારા મદદગાર કોણ છે ? હવારીઓ બોલ્યા કે અલ્લાહના (દીનના) મદદગાર અમે છીએ, અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને (અય ઈસા! તું) સાક્ષી રહેજે કે નિસંશય! અમે મુસલમાન (ફરમાબરદાર) છીએ.

رَبَّنَا آمَنَّا بِمَا أَنْزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ

الشَّاهِدِينَ ﴿٥٣﴾

(પ૩) અથ અમારા પરવરદિગાર ! તેં જે કાંઈ ઉતાર્યું છે તેના પર અમે ઈમાન લાવ્યા અને અમોએ(તારા) રસૂલનું અનુકરણ કર્યું, જેથી તું (સત્યની) સાક્ષી આપનારાઓની સાથે અમને (પણ) લખી લે.

وَمَكْرُؤًا وَّمَكْرَ اللَّهِ ۗ وَاللَّهُ خَيْرُ الْمَكْرِيْنَ ﴿٥٤﴾

(પ૪) અને તે (ચહૂદી)ઓ (ઈસા સાથે) એક ચાલ ચાલ્યા અને અલ્લાહ પણ (તેમની વિરુદ્ધ) એક

ચાલ ચાલ્યો; અને અલ્લાહ સૌથી શ્રેષ્ઠ ચાલ
ચાલનારો છે.

إِذْ قَالَ اللَّهُ يُعِيسِي إِيَّيْ مُتَوَفِّيكَ وَرَافِعَكَ إِلَيَّ وَمُطَهِّرَكَ مِنَ
الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا
إِلَى يَوْمِ الْقِيَامَةِ ۗ ثُمَّ إِلَىٰ مَرْجِعِكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا
كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ ﴿٥٥﴾

(૫૫) (અને તે સમયને યાદ કર) જ્યારે અલ્લાહે
ફરમાવ્યું કે અય ઈસા ! હું તારી (દુનિયામાં
રહેવાની) મુદત પૂરી કરનાર છું અને તને મારી
તરફ ઉઠાવી લેનાર છું અને નાસ્તિકોની સંગતથી
દૂર રાખી તને પાક પવિત્ર રાખનાર છું અને જે

લોકોએ તારી તાબેદારી કરી છે તેમને કયામત સુધી નાસ્તિકો પર ચઢીયાતા રાખનાર છું, પછી તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ થશે પછી (તે દિવસે) તેમાંના જે વિષય સંબંધી તમે મતભેદ કરતા હતા તેમાં હું તમારી વચ્ચે ચુકાદો આપીશ.

فَأَمَّا الَّذِينَ كَفَرُوا فَأَعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِي الدُّنْيَا
وَالْآخِرَةِ وَمَا لَهُمْ مِّنْ نَّاصِرِينَ ﴿٥٦﴾

(૫૬) પછી જે લોકોએ ઈન્કાર કર્યો છે તેમને દુનિયા તથા આખેરતમાં સખ્ત શિક્ષા કરીશ, અને તેમનો મદદગાર કોઈપણ હશે નહિ.

وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ط
وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ ﴿٥٧﴾

(૫૭) અને જેઓ ઈમાન લાવ્યા તથા સત્કાર્યો કર્યા તો (અલ્લાહ) તેમને તેમનો બદલો પૂરેપૂરો આપશે; અને અલ્લાહ ઝુલમગારોને દોસ્ત રાખતો નથી.

ذَلِكَ نَسُؤُهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ ﴿٥٨﴾

(૫૮) (અય રસૂલ!) અમે તને (અમારી) આયતો તથા આ હિકમતવાળા વર્ણન (કુરઆન)માંથી આ બયાન પઠી સંભળાવીએ છીએ.

إِنَّ مَثَلَ عِيسَىٰ عِنْدَ اللَّهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِنْ تُرَابٍ ثُمَّ
قَالَ لَهُ كُنْ فَيَكُونُ ﴿٥٩﴾

(૫૯) બેશક અલ્લાહની પાસે ઈસાનો દાખલો આદમના જેવો છે; તેને માટીથી પેદા કર્યા પછી તેને ફરમાવ્યું "થઈ જા" અને તે થઈ ગયો.

الْحَقُّ مِنْ رَبِّكَ فَلَا تَكُنْ مِنَ الْمُبْتَرِينَ ﴿٦٠﴾

(૬૦) આ ખબર તારા પરવરદિગાર તરફથી સાચી છે માટે તું શંકા કરનારાઓ માંહેનો થજે નહિ.

فَمَنْ حَاجَّكَ فِيهِ مِنْ بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا
 نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنْفُسَنَا
 وَأَنْفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَعْنَتَ اللَّهِ عَلَى الْكٰذِبِينَ ﴿٥٩﴾

(૬૧) તથાપિ તે (ઈસા) વિષે જે જ્ઞાન તને મળી
 ચૂક્યું છે તે પછી પણ જે કોઈ તારી સાથે તે
 (ઈસા)ના સબંધમાં તકરાર કરે તો તું કહે કે આવો
 અમે અમારા પુત્રોને બોલાવીએ અને તમે તમારા
 પુત્રોને બોલાવો અને અમે અમારી બેટીઓને
 બોલાવીએ અને તમે તમારી બેટીઓને (બોલાવો)
 અને અમે પોતાના નફસોને બોલાવીએ તથા તમે
 તમારા નફસોને બોલાવો; પછી આપણે (અલ્લાહ

પાસે) કરગરીને દુઆ કરીએ અને જૂઠું
બોલનારાઓ પર અલ્લાહની ફિટકાર કરીએ.

إِنَّ هَذَا لَهُوَ الْقَصُّ الْحَقُّ ۖ وَمَا مِنْ إِلَهٍ إِلَّا اللَّهُ ۗ وَإِنَّ اللَّهَ
لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ﴿٣٢﴾

(૬૨) નિસંશય આ સાચું વર્ણન છે, અને અલ્લાહના
સિવાય અન્ય કોઈ પૂજ્ય નથી; અને બેશક
અલ્લાહ એજ જબરદસ્ત હિકમતવાળો છે.

فَإِنْ تَوَلَّوْا فَإِنَّ اللَّهَ عَلَيْهِمُ بِالْمُفْسِدِينَ ﴿٣٣﴾

(૬૩) પછી જો (આ છતાંય) તેઓ મોઢું ફેરવે તો
બેશક અલ્લાહ ફિત્નાખોરોને સારી પેઠે જાણે છે.

قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَى كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا
 نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا
 أَرْبَابًا مِّنْ دُونِ اللَّهِ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا
 مُسْلِمُونَ ﴿١٣﴾

(૬૪) (અય રસૂલ!) કહે કે અય કિતાબવાળાઓ !
 એક એવી વાત તરફ આવી જાઓ જે અમારી
 તથા તમારી વચ્ચે સમાન છે (અને તે એ) કે
 આપણે અલ્લાહના સિવાય કોઈની બંદગી કરીએ
 નહિ તથા કોઈને તેનો શરીક બનાવીએ નહિ અને
 અલ્લાહને મૂકી આપણામાંથી કોઈએ બીજાઓને
 ખુદા માનવા નહિ; આ છતાં જો તેઓ મોંઢું ફેરવી

લે તો કહી દો કે આ (વાત)ના સાક્ષી રહેજો કે અમે તો મુસલમાન છીએ.

يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنزِلَتِ التَّوْرَةُ
وَإِلَّا مُجِئِلًا إِلَّا مِنْ بَعْدِهِ ۗ أَفَلَا تَعْقِلُونَ ﴿٦٥﴾

(૬૫) અય કિતાબવાળાઓ! ઈબ્રાહીમ સબંધી (જાણી જોઈને) શા માટે તકરાર કરો છો? જ્યારે તૌરેત અને ઈન્જીલ ઉતારવામાં આવ્યા ન હતાં પણ તે (ઈબ્રાહીમ)ના પછીજ; છતાં તમે સમજતા નથી?

هَآأُنْتُمْ هَؤُلَاءِ حَآجَجْتُمْ فِيمَآ لَكُمْ بِهِ عِلْمٌ فَلِمَ تُحَآجُّونَ فِيمَآ
لَيْسَ لَكُمْ بِهِ عِلْمٌ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنْتُمْ لَا تَعْلَمُونَ ﴿٦٦﴾

(૬૬) અથ લોકો ! તમે એજ તો છો કે જેઓ હમણાં જે વિષે થોડું ઘણું જ્ઞાન ધરાવો છો તેના સબંધમાં કજિયો કરતા હતા પછી જે વિષે તમને જ્ઞાન જ નથી તે વિષે શાને લડવા લાગો છો ? અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી.

مَا كَانَ إِبْرَاهِيمَ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَكِنْ كَانَ حَنِيفًا
 مُسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ﴿٦٧﴾

(૬૭) ઈબ્રાહીમ ન યહૂદી હતો ન ખ્રિસ્તી; બલકે તે (દ્રઢતાપૂર્વક) એક અલ્લાહને માનનાર મુસ્લિમ હતો; અને મુશરીકો માંહેનો ન હતો.

إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيمَ لَلَّذِينَ اتَّبَعُوهُ وَهَذَا النَّبِيُّ
وَالَّذِينَ آمَنُوا وَاللَّهُ وَلِيُّ الْمُؤْمِنِينَ ﴿٦٨﴾

(૬૮) નિસંશય સઘળા લોકોની સરખામણીમાં
ઈબ્રાહીમ (સાથે)નો વધુ સબંધ તે લોકોને છે કે
જેઓ તેના અનુયાયી છે અને (ખાસ કરીને) આ
નબીને છે તથા તે લોકોને છે કે જેઓ ઈમાન
લાવ્યા છે; અને અલ્લાહ સર્વે મોમીનોનો
કાર્યસાધક છે.

وَدَّتْ طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّوكُمْ ۖ وَمَا يُضِلُّونَ
إِلَّا أَنْفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ﴿٦٩﴾

(૬૯) (અય મુસલમાનો!) કિતાબવાળાઓના એક ટોળાએ ઘણી ઈચ્છા કરી કે તેઓ તમને ગુમરાહ કરે; (પરંતુ ખરી રીતે જોતાં) તેઓ પોતાના સિવાય બીજા કોઈને ગુમરાહ કરતા નથી પણ (તેનું) તેમને ભાન નથી.

يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَأَنْتُمْ تَشْهَدُونَ ﴿٦٩﴾

(૭૦) અય કિતાબવાળાઓ! અલ્લાહની આયતોનો શા માટે ઈન્કાર કરો છો જ્યારે કે તમે પોતે જ (તેની સત્યતાની) સાક્ષી પણ આપી રહ્યા છો.

يَأْهَلِ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ
وَأَنْتُمْ تَعْلَمُونَ ﴿٤١﴾

(૭૧) અથ કિતાબવાળાઓ ! સત્યને અસત્યની સાથે શા માટે ભેળવી નાખો છો ? અને જાણી જોઈને સત્યને શા માટે સંતાડો છો ?

وَقَالَتْ طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى
الَّذِينَ آمَنُوا وَجَهَ النَّهَارِ وَكُفِّرُوا وَآخِرَ مَا لَعَلَّهُمْ يَرْجِعُونَ ﴿٤٢﴾

(૭૨) અને કિતાબવાળાઓના એક ટોળાએ કહ્યું કે ઈમાન લાવનારાઓ પર જે કાંઈ ઉતર્યું છે તેના પર દિવસના પ્રથમ ભાગમાં તમે પણ ઈમાન લાવો અને તેના પાછલા ભાગમાં (તેનાથી) ફરી

જતા રહો (આમ કરવાથી) કદાચને તે
(મુસલમાનો) પોતાના ધર્મથી પાછા ફરી જાય.

وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَنْ تَبِعَ دِينَكُمْ ۗ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَىٰ اللَّهِ ۗ
أَنْ يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيْتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِنْدَ رَبِّكُمْ ۗ
قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ ۗ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ
عَلِيمٌ ﴿٤٣﴾

(૭૩) (અને યહૂદીઓ કહે છે કે) જેઓ તમારા ધર્મ
અનુસાર ચાલ્યા છે તેમના સિવાય બીજાનું (કહ્યું)
માનવું નહિ; (અય રસૂલ!) તું કહે કે નિસંશય (મૂળ)
હિદાયત અલ્લાહનીજ હિદાયત છે (અને
યહૂદીઓએ આપસમાં કહ્યું કે આ પણ માનશો

નહિ) કે જે (ઉમદા ધર્મ) તમને આપવામાં આવ્યો છે તેના જેવો જ બીજા કોઈને પણ આપવામાં આવે અથવા તમારા પરવરદિગારની પાસે તેઓ તમારાથી (ચઢિયાતા રહીને) કાંઈ વાદવિવાદ કરી શકે; (અય રસૂલ!) કહે કે નિસંશય શ્રેષ્ઠતા આપવી અલ્લાહનાજ હાથમાં છે, તે યાહે છે તેને આપે છે; અને અલ્લાહ મહા ઉદાર (અને) સર્વજ્ઞ છે.

يَخْتَصُّ بِرَحْمَتِهِ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ﴿٤٢﴾

(૭૪) તે જેને યાહે છે પોતાની રહેમત માટે ખાસ ચુંટી કાઢે છે; અને અલ્લાહ મહાન કૃપાળુ છે.

وَمِنْ أَهْلِ الْكِتَابِ مَنْ إِنْ تَأْمَنَهُ بِقِنطَارٍ يُؤَدِّيهِ إِلَيْكَ ۚ
 وَمِنْهُمْ مَنْ إِنْ تَأْمَنَهُ بِدِينَارٍ لَّا يُؤَدِّيهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ
 عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي الْأُمِّينَ
 سَبِيلٌ ۗ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ ﴿٤٥﴾

(૭૫) અને કિતાબવાળાઓમાંથી કેટલાક એવા છે
 કે જો તેમની પાસે તું (નાણાંનો) ઢગ અમાનત
 રાખે તો તે તને (જ્યારે જોઈએ ત્યારે) પાછો આપી
 દેશે, અને તેમનામાંથી કેટલાક એવા છે કે જો તું
 એક દીનાર પણ તેમને સોંપે તો (જ્યાં સુધી)
 તેમના માથે સતત ઉભો રહી તકાઓ ન કરે ત્યાં
 સુધી તને પાછો આપશે નહિ; તેનું કારણ આ છે કે

તેઓ કહે છે કે અમારા માથે આ જાહીલોના (અર્થાત મુસલમાનોના) (નાણાં લઈને પાછા ન આપવાના) સબંધમાં કાંઈ ગુનોહ નથી, અને તેઓ જાણી જોઈને અલ્લાહ વિરુદ્ધ ખોટું બોલે છે.

بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ ﴿٦١﴾

(૭૬) અલબત્ત જોણે પોતાનો વાયદો પૂરો કર્યો તથા (ગુનાહથી) બચીને ચાલ્યો તો નિસંશય અલ્લાહ (પણ ગુનાહથી) બચનારાઓને દોસ્ત રાખે છે.

إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا أُولَٰئِكَ
 لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ
 يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ﴿٤٤﴾

(૭૭) બેશક જે લોકો અલ્લાહને (આપેલા) વાચદા
 તથા પોતાની સોગંદોના બદલામાં નજીવી કિંમત
 લઈ લે છે (તેઓ) એજ તો છે કે જેમના માટે
 આખેરતમાં કાંઈ ભાગ નથી અને ન અલ્લાહ
 તેમની સાથે વાત કરશે અને ન કયામતના દહાડે
 તેમને (માયાળુ નજરે) નિહાળશે અને ન તેમને
 (ગુનાહોની ગંદકીથી) પાક કરશે, અને તેમના માટે
 દુઃખભરી સજા છે.

